



Accredited Grade "A" by NAAC  
(3<sup>rd</sup> Cycle)

## સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

પદવી પદવી વિભાગ -૫ યુનિવર્સિટી કેમ્પસ- રાજકોટ ,યુનિવર્સિટી રોડ , ૩૬૦૦૦૫  
ફોન નં.૦૨૮૧-૨૫૭૬૫૧૧ એક્સ્ટે.નં.૭૬૧ - ૭૭૧ ફેક્સ નં. (૦૨૮૧) ૨૫૮૬૪૧૧

ઈ-મેઇલ : exam05@sauuni.ac.in

### પરિપત્ર :-

આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત અનુસ્નાતક કેન્દ્રના મા.અધ્યક્ષશ્રી,યુનિવર્સિટી સંલગ્ન કોલેજના કાર્યરત અનુસ્નાતક કેન્દ્રના મા.પ્રોફેસર-ઇન-ચાર્જશ્રી તેમજ સંલગ્ન કોલેજના મા.આચાર્યશ્રી ને જણાવવાનું કે, આગામી માર્ચ/એપ્રિલ-૨૦૨૧ માં લેવાનાર ડિગ્રી કક્ષાની પરીક્ષામાં નીચે દર્શાવેલ તમામ સુચનાઓનું સંપૂર્ણ પરિપાલન કરવાનું રહેશે. ( તબીબી, હોમિયોપેથી અને આર્કિટેક્ચર વિદ્યાશાખાઓને લાગુ પડશે નહીં.)

૧. આર્ટ્સ, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, ફાર્મસી, ગૃહવિજ્ઞાન, મેનેજમેન્ટ, રૂરલ સ્ટડીઝ, કાયદા અને પરફોર્મિંગ આર્ટ્સ વિદ્યાશાખાઓની પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ માર્ચ/એપ્રિલ-૨૦૨૧ ના તબક્કાઓમાં ડિગ્રી કક્ષાઓની પરીક્ષા આપનાર હોય તેવા વિદ્યાર્થીઓએ ડિગ્રી કક્ષાની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે **Apply Degree**  ઉપર ટીક કરવાથી ડિગ્રી ફોર્મની ઓન લાઇન એન્ટ્રી થઇ જશે.
૨. આ યુનિવર્સિટીની પદવી મેળવવા માટે ફી રૂ.૧૨૫/-નિયત કરવામાં આવેલ છે.
૩. વિદ્યાર્થીઓના નામ-સરનામાંની માહિતીની એન્ટ્રી ઉપરોક્ત દર્શાવેલ વિગતેથી કોલેજ દ્વારા થનાર હોય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે કોલેજની રહેશે. જે ભરાયેલ ફોર્મમાં દર્શાવેલ એડ્રેસના આધારે વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો યુનિવર્સિટી દ્વારા SPEED POST ના માધ્યમથી ડિસ્પેચ કરવામાં આવશે.
૪. જે રેગ્યુલર વિદ્યાર્થીઓ પદવી મેળવવા માટે પરીક્ષા ફોર્મ સાથે પદવી ફોર્મ ભરેલ હોય તે ફરજિયાત વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વિગતો ઓનલાઇન ફી મેમો જનરેટ કરી ઓનલાઇન ફી પેમેન્ટ કરવાનું રહેશે ઓફલાઇન પેમેન્ટ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.
૫. નિયત કરેલ એન્ટ્રીની છેલ્લી તારીખ બાદ **Consolidated Report** જેવા કે (**Print Degree College Memo** અને **Students Wise Application Report**) અને પદવી ફોર્મનું ઓનલાઇન પેમેન્ટ કરવા માટે નં.પરીક્ષા/CE/૨૧૧/૨૧૦૨૧ તા.૧૪-૦૨-૨૦૨૧ નો પરિપત્ર ધ્યાને લઈ આ પરીપત્રમાં દર્શાવ્યા મુજબની વિગતો પદવી વિભાગને ફરજિયાત Email [exam05@sauuni.ac.in](mailto:exam05@sauuni.ac.in) કરી આપવાનો રહેશે.
૬. મેન્યુલ પદવી ફોર્મ ભરીને કોલેજ પોતાની પાસે કોલેજ રેકર્ડ સ્વરૂપે રાખવાના રહેશે અને યુનિવર્સિટીને જયારે જરૂરીયાત પડે ત્યારે કોલેજ દ્વારા યુનિવર્સિટીને જમા કરાવવાના રહેશે.
૭. જે કોઈ વિદ્યાર્થીએ એક વખત Online પદવી ફોર્મ ફી ભરેલ હોય અને તે વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તેવા વિદ્યાર્થીએ ફરીથી ઉપરોક્ત દર્શાવેલ વિગતેથી Online પદવી ફોર્મ ભરવાનું રહેશે.
૮. જે કોઈ જુના રીપીટર વિદ્યાર્થીઓ આગામી માર્ચ/એપ્રિલ -૨૦૨૧ માં લેવાનાર ડિગ્રી કક્ષાની પરીક્ષાના આવેદનપત્રો ભરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીની પદવી ફી જમા કરવામાં આવેલ હોય તો કોલેજ દ્વારા તેનો આધાર રજૂ કરવાનો રહેશે. અને જો પદવી ફી ન ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પદવી ફી કેશ વિભાગમાં ફરજિયાત રૂબરૂમાં જમા કરાવવાની રહેશે.
૯. નિયત કરેલ છેલ્લી તારીખ બાદ કરવામાં આવતી એન્ટ્રી સોફ્ટવેર પ્રોગ્રામ સ્વીકારશે નહીં જે ધ્યાને લેવા વિનંતી પરીક્ષા ફોર્મ ભરવાની જે સમય મર્યાદા છે તે જે સમય મર્યાદામાં ડિગ્રી ફોર્મ ભરી શકાશે.
૧૦. કોલેજ દ્વારા એક વખત ફી ભર્યા પછી પરત મળી શકશે નહીં કે ભવિષ્યના હેતુ માટે અનામત રાખવામાં આવશે નહીં.

### ઓનલાઇન એન્ટ્રી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ

➤ [www.saurashtrauniversity.co.in](http://www.saurashtrauniversity.co.in) & [www.saurashtrauniversity.edu](http://www.saurashtrauniversity.edu)

*hijhni*  
પરીક્ષા નિયામક

નં.પરીક્ષા-૫ /૧૧૭૨/૨૦૨૧

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.યુનિવર્સિટી કેમ્પસ. યુનિવર્સિટી રોડ. રાજકોટ - ૩૬૦ ૦૦૫.

તા. ૧૭-૦૨-૨૦૨૧

### નકલ સવિનય રવાના :

૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના માનનીય વડાઓ,
૨. માનનીય કુલપતિશ્રી/મા.કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ
૩. વિભાગીય અધિકારીશ્રી પરીક્ષા વિભાગ -૧-૨-૩-૪-૫-૬-બાહ્ય -કોમ્પ્યુટર - ખાનગી